



Commencement Letter (Rajachitthi)

02 MAY 2017

Date :

BLNTSWZ060317/GDR/A8170/R0/M1

Case No:

Rajachitthi No : 8418/060317/A8170/R0/M1

Arch./Engg No.: ER0804040821R1

Arch./Engg. Name: SONI KINAL D.

S.D. No.: SD0447121119

S.D. Name: NIPUL B. PATEL

C.W. No.: CW0781130921

C.W. Name: PANDYA HARDIKKUMAR H.

Developer Lic. No.: DEV247230320

Developer Name: YASHVI CONSTRUCTION

Owner Name :

PARTNER OF RATNAKAR INFRABUILD KISHOR S SHAH

Owners Address :

501,PANCHSHIL APP.,NR.STATE BANK OF PATIYALA,SHANTINAGAR, USHAMANPURA Ahmedabad
Ahmedabad Ahmedabad India

Occupier Name :

PARTNER OF RATNAKAR INFRABUILD KISHOR S SHAH

Occupier Address :

501,PANCHSHIL APP.,NR.STATE BANK OF PATIYALA,SHANTINAGAR, USHAMANPURA Ahmedabad
Ahmedabad Ahmedabad Gujarat

Election Ward:

04 - SABARMATI

Zone : WEST

TPScheme

23 - SABARMATI

Final Plot No 174

Sub Plot Number

Block/Tenament No.: BLOCK-B

Address:

SAMPRAITI ELEGANCE,CHANDANWILLA BUNGLOW,OPP RAGHUNANDAN FLATS,NEAR WATER
TANK,H.H.SCHOOL ROAD,SABARMATI,AHMEDABAD-380013.

Height of Building: 24.63 METER

Floor Number	Usage	BuiltUp Area (In Sq mtr.)	Total Nos. of Residential Units	Total Nos. of Non Residential Units
Ground Floor	PARKING	203.00	0	0
First Floor	RESIDENTIAL	203.00	2	0
Second Floor	RESIDENTIAL	203.00	2	0
Third Floor	RESIDENTIAL	203.00	2	0
Fourth Floor	RESIDENTIAL	203.00	2	0
Fifth Floor	RESIDENTIAL	203.00	2	0
Sixth Floor	RESIDENTIAL	100.32	1	0
Seventh Floor	RESIDENTIAL	34.25	0	0
Stair Cabin	STAIR CABIN	23.13	0	0
Lift Room	LIFT	1578.7	13	0
Total		1578.7	13	0

[Signature]

21/5/17

[Signature]

A-3-36A

Sub Inspector(Civic Center)

Asst. T.D.O./Asst. E.O (Civic Center)

Nilesh Baranda
Dy T.D.O.
WEST

ARJAV J. SHAH (JC)
Dy MC
WEST

Note / Conditions:

- (1)THIS DEVELOPMENT PERMISSION IS GRANTED WITH CONDITION THAT APPLICANT AND ENGG./ARCH.WILL OBEY AS PER ALL BONDS AND AFFIDAVITS PRODUCED BY APPLICANT AND ENGG./ARCH.
- (2)THIS APPROVAL IS GIVEN ACCORDING TO MUNICIPAL COMMISSIONER OFFICE ORDER DATED 02/03/05 AND OFFICE ORDER NO-42.DT.-13/06/06.
- (3)THE OWNER/DEVELOPER SHALL CARRY OUT RAIN WATER HARVESTING SYSTEM AS WELL AS RAIN WATER DISPOSAL AS PER GDCR-2021 CLAUSE NO:- 27.2.
- (4)THIS DEVELOPMENT PERMISSION IS GRANTED UNDER G.D.C.R.-2021 AS PER LETTER NO: GHV/207 OF 2014/DVP-112013-4777-L, DATED:-20/12/2014 OF URBAN DEVELOPMENT AND URBAN HOUSING DEPARTMENT, GOVT. OF GUJARAT.
- (5)OWNER-APPLICANT-DEVELOPER SHALL HAVE TO PROVIDE BARRICADE OF STEEL-SHEETS/TIN-SHEETS OF SUFFICIENT HEIGHT (NOT LESS THAN 3.00MT),DURING CONSTRUCTION/DEMOLITION ACTIVITY, AT ALL EDGES OF PLOT FOR SAFETY PURPOSE.
- (6)THIS CASE HAS BEEN SCRUTINIZED AND APPROVED BY BUILDING PLAN SCRUTINY POOL ON DT:-11/04/2017.
- (7)THIS DEVELOPMENT PERMISSION IN RESIDENTIAL ZONE-(IAS SHOWN IN PLAN) FOR RESI. BUILDING IS GRANTED AS PER THE ORDER/APPROVAL GIVEN BY DY.M.C.(U.D.) ON DT.10/04/2017 IN RESPECT OF BUILDING HEIGHT LIMIT UP TO 25.00 MT,ALL TERMS AND CONDITION MENTION IN ORDER WILL BE APPLICABLE AND BINDING TO OWNER/APPLICANT.
- (8)THIS DEVELOPMENT PERMISSION IS GIVEN ON THE CONDITION THAT OWNER/APPLICANTS HAVE TO PROVIDE TEMPORARY RESIDENTIAL ACCOMMODATION FOR SKILLED/UNSKILLED CONSTRUCTION LABOURS IN THEIR PREMISES WITH PROPER SANITATION FACILITY. PUBLIC SPACE/ROAD WILL NOT BE ENCHROACHED FOR THE SAME IN ANY CASE AS PER OWNER/APPLICANTS SUBMIT THE NOTERISED UNDERTAKING FOR THE SAME ON DT.01/05/2017.
- (9)THE DEVELOPMENT PERMISSION IS GIVEN ON THE BASIS OF NOTERISED UNDERTAKING ON DT. 01/05/2017 BY OWNER/ APPLICANT AND DEVELOPERS FOR THE RIGHTS TO DEVELOP AND CONSTRUCTION ON THE SAID LAND BY DEVELOPERS AND IT WILL BE BINDING AND APPLICABLE TO BOTH PARTIES.
- (10)THIS DEVELOPMENT PERMISSION IS GIVEN AS PER NOTERIZED UNDERTAKING GIVEN ON DT. 24/04/2017 FOR PARKING DEPOSIT OF HON. HIGH COURT CASE NO. C.A. (FOR STAY) NO. 1256 OF 2013 IN L.P.A. NO. 1397 OF 2013 IN S.C.A. NO. 12467 OF 2013. THE FINAL DECISION /ORDER OF HON. COURT WILL BE APPLICABLE TO OWNER /APPLICANT.
- (11)THIS PERMISSION IS GIVEN ON THE BASIS OF MEASURNMENT AND LOCATION OF PLOT MENTION IN OPINION FOR SCHEME IMPLIMENTATION GIVEN BY TOWN DEV.INSP.(W.Z.) A.M.C. DT. 08/03/2017.
- (12)THIS PERMISSION IS GIVEN AS PER OPINION OF (W.Z) FOR BETTERMENT CHARGE ON DT.-18/04/2016.
- (13)ALL TERMS AND CONDITION MENTION IN EARLIER B.U. PERMISSION CASE NO:BU/432 ON DT:-24/07/1984 WILL BE APPLICABLE AND BINDING TO OWNER/APPLICANT.
- (14)APPOINTMENT OF FIRE PROTECTION CONSULTANT BY OWNER/APPLICANT BEFORE APPLYING FOR B.U. PERMISSION AS PER NOTERISED UNDERTAKING GIVEN BY OWNER/APPLICANT ON DATE:-01/05/2017.
- (15)AIR PORT N.O.C. WILL BE PRODUCED BY OWNER/APPLICANT BEFORE DEVELOPMENT.
- (16)THIS DEVELOPMENT PERMISSION IS GIVEN WITHOUT SIGNATURE OF

19/05/17-21/05/17 / 5/17/17

નિયમો તેમજ પ્રવર્તમાન નીતિ- નિયમોને અનુસરીને મકાન બાંધકામ તેમજ ઉપયોગ કરવાનો રહેશે. તેમજ આ અંગેના તમામ કાયદા તેમજ પેટા કાયદાનું પાલન કરવાનું રહેશે. તેમજ તેમાં જે કોઈ અકુશો તથા શરતો મુકવામાં આવી છે તેનાથી જો નુકશાન થતું હશે તો પણ નુકશાનની બદલો માંગ્યા સિવાય અરજદાર/માલિકને તેનો અમલ કરવાનો રહેશે.

૨. અરજદાર/માલિકને કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિઠ્ઠી) આપવામાં આવ્યું હશે તો પણ થી ગુ. ટા. પ્લા. અને અર્બન ડેવ. એક્ટ, ૧૯૭૬ મુજબ ટા. પ્લા. સ્કીમ અન્વયેની રિમાન્ડ/ફાળો તેમજ અન્ય કાયદા હેઠળ કોઈ ચાર્જ કે લેણાં બાકી હશે કે ભવિષ્યમાં ચૂકવવાના થશે તો તે મ્યુ. કોર્પો./સિદ્ધાંત સત્તામાં જમા કરાવવાના રહેશે.

૩. અરજદાર/માલિકને કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિઠ્ઠી)માં જણાવ્યા મુજબની શરતોનું પાલન કરવાનું રહેશે. કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિઠ્ઠી)માં જણાવ્યા મુજબની શરતો પૈકી કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો મ્યુનિસિપલ કોર્પોરેશન તે શરતોનો અમલ કરાવી શકશે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તેવા કૃત્યને લીધે જે કંઈ નુકશાન, ખોટ, કે હરકત અરજદાર/માલિકને થશે તે બદલ કોઈપણ પ્રકાર નો બદલો મળી શકશે નહીં.

૪. કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિઠ્ઠી) ની તારીખથી એક વર્ષમાં બાંધકામ શરૂ કરવામાં આવેલ નહીં હોય કે નિયત સમયમર્યાદામાં તેના રીન્યુઅલ અંગેની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ નહીં હોય તો કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિઠ્ઠી) સાથે આપેલ પરવાનગી આપો આપ રદ થયેલ ગણાશે.

૫. મંજૂર થયેલ પ્લાન મુજબનું સ્થળ પર બાંધકામ પુરું થયેથી થી જી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૮ ની કલમ-૨૬૩ તેમજ સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમો(જી.ડી.સી.આર.) ની જોગવાઈ મુજબ મકાન વપરાશની પરવાનગી (બી.યુ. પરમીશન) મેળવ્યા બાદ જ મંજૂર કરેલ બાંધકામનો વપરાશ કરી શકાશે. થી જી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૮ની કલમ - ૩૭ થી ૩૮માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણેના ધંધા અગર ઉપયોગ માટે કોઈપણ જગ્યાનો ઉપયોગ કરતો પહેલા અમ.મ્યુનિ. કોર્પોરેશન/ સહાય સત્તા પાસેથી જરૂરી લાયસન્સ/પરવાના મેળવવાના રહેશે.

૬. પ્લોટના માપો તથા ક્ષેત્રફળ મળી રહેતા હોય તે માટેની સાઈટ તરીકે પ્લોટ મોગ્ય થાય અને પ્લોટ સ્વચ્છ અને ઢોળાવવાળો (બાડા-પોલાણનો ભાગ રહે નહીં અને પાણી ભરાઈ રહે નહીં તેવો) થાય તો જ બાંધકામ શરૂ કરી શકાશે.

૭. GRANT OF THIS DEVELOPMENT PERMISSION SHALL NOT MEAN ACCEPTANCE OF CORRECTNESS, CONFIRMATION, APPROVAL OR ENDORSEMENT OF TITLE OF THE LAND, BUILDING, EASEMENT RIGHTS, VARIATION IN THE AREA FROM RECORDS, STRUCTURAL REPORTS & STRUCTURAL DRAWINGS, WORKMANSHIP AND SOUNDNESS OF MATERIAL USED IN CONSTRUCTION OF THE BUILDING, LOCATION AND BOUNDARY OF PLOT , SOIL INVESTIGATION REPORT ETC. AND SHALL NOT BIND OR RENDER THE AUTHORITY /AMC OFFICIALS LIABLE IN ANY WAY IN THIS REGARDS (UNDER G.D.C.R. CL No.: 3.10)

૮. પ્લાનમાં મંજૂર કર્યા મુજબનું બાંધકામ સ્થળ ઉપર શરૂ કરતા પહેલા બીન પરવાનગીના/બિન અધિકૃત કાર્યા - પાકા બાંધકામ અરજદાર/માલિકે પોતાના ખર્ચે જોખમે દૂર કરવાના રહેશે.

૧૦. પ્લાનમાં મંજૂર કર્યા મુજબનું બાંધકામ સ્થળ ઉપર શરૂ કર્યોથી સામાન્ય વિકાસ નિયમો(જી.ડી.સી.આર.) મુજબ તબક્કાવાર પ્રોગ્રેસ ચેક કરાવવાના રહેશે. ૧૧. કેસમાં રજૂ કરવાના થતા સોઈલ રીપોર્ટ, સ્ટ્રક્ચરલ રીપોર્ટ, સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ બોન્ડ-અન્ટરટેઈંગ-બાંહેધરી વિગેરે ફક્ત કોર્પોરેશનના રેકર્ડ હેતુ માટે હોઈ તે અંગેની જવાબદારી અ.મ્યુ. કોર્પોરેશનની તથા અધિકારી / કર્મચારીની રહેશે નહિ. આ અંગે જવાબદાર અરજદાર/માલિક/ડિવલપર તથા એન્જનીયર/ આર્કિટેક્ટ સ્ટ્રક્ચરલ એન્જનીયર, ક્લાર્ક ઓફ વર્ક્સ રજુ કરેલ પ્રમાણપત્રો / બાંહેધરી તથા રીપોર્ટને આધીન સંધર્મી જવાબદારી તેઓની (અરજદાર/માલિક / ડેવલપર તથા એન્જનીયર /આર્કિટેક્ટ સ્ટ્રક્ચરલ એન્જનીયર, ક્લાર્ક ઓફ વર્ક્સ) રહેશે.

૧૨. બીલ્ડીંગ મટીરીયલ કે કાટમાળ મ્યુ. રસ્તા ઉપર કે ફૂટપાથ ઉપર નાંખવામાં આવશે. તેમજ આ બાંધકામની કમેન્સમેન્ટ સર્ટીફિકેટ(રજાચિઠ્ઠી)રદ કરવા અંગેની નિયમાનુસારની પેનલ્ટીની રકમ અરજદાર/માલિક પાસેથી વસૂલ કરવામાં આવશે. તેમજ આ બાંધકામની કમેન્સમેન્ટ સર્ટીફિકેટ(રજાચિઠ્ઠી)રદ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

૧૩. સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમો(જી.ડી.સી.આર.)ની જોગવાઈ તેમજ જે તે સમયે સરકારથી દ્વારા જાહેર કરાયેલ નીતિ અનુસાર પરકોલેટીવલ/પીટ, વોટર હાર્વેસ્ટીંગ, ટ્રીન-પ્લાન્ટશન/વૃક્ષારોપણની જોગવાઈ બીલ્ડીંગ પ્લોટમાં કરવાની રહેશે. સેપ્ટીક ટેન્ક તથા સોકલેવની સાઈઝ તથા સંખ્યા, ઈન્સેક્શન ચેમ્બર, મેનહોલ વિગેરે ડ્રેનેજ લેઆઉટમાં બતાવ્યા મુજબના સ્થળે કરવાની જવાબદારી અરજદાર/માલિક/ડિવલપર તથા એન્જનીયર/ સ્ટ્રક્ચરલ એન્જનીયર, ક્લાર્ક ઓફ વર્ક્સની રહેશે.

૧૪. મકાનમાં બાંધકામ/ડિમોલીશ કરતી વખતે અથવા ત્યારબાદ આજુબાજુના મકાનો/ચિલકતને અન્ય કોઈપણ જાતનું નુકશાન કે જાનહાનની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી અરજદાર/માલિક / ડેવલપર તથા એન્જનીયર/ આર્કિટેક્ટ સ્ટ્રક્ચરલ એન્જનીયર, ક્લાર્ક ઓફ વર્ક્સની રહેશે. અ.મ્યુ.કોર્પોરેશન આ બાબતે દિવાની યા કોજદારી રાહે જવાબદાર ગણાશે નહિ. તેમજ આજુબાજુના રહીશોને કોઈપણ સમયે ખલેલ / નુકશાન થાય નહિ તે રીતે બાંધકામ / ડિમોલિશનની કામગીરી કરવાની રહેશે.

૧૫. મંજૂર થયેલા પ્લાન તેમજ કમેન્સમેન્ટ સર્ટીફિકેટ(રજાચિઠ્ઠી)ની નકલ દરેક ચેમ્બરને ફરજીયાત આપવાની રહેશે અને બાંધકામની સાઈટ પર નોટિસ બોર્ડ ઉપર જાહેરમાં જોઈ શકાય તે રીતે દર્શાવવાની રહેશે.

૧૬. મકાન વપરાશની પરવાનગી (બી.યુ. પરમીશન) મેળવ્યા બાદ જ ડ્રેનેજ / પાણી તથા અન્ય સર્વિસ-યુટીલીટી માટે નિયમાનુસાર અરજી કરી શકાશે. ૧૭. બાંધકામ તથા અન્ય બાબતો સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમો(જી.ડી.સી.આર.) સાથે સુસંગત નહીં હોય કે સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમો(જી.ડી.સી.આર.)ના વિનિયમ ડી.૬ મુજબ અરજદાર માલિકે ખોટી રજુઆત અથવા ખોટા દસ્તાવેજ પુરાવા રજૂ કરેલ હશે તો આ કમેન્સમેન્ટ સર્ટીફિકેટ(રજાચિઠ્ઠી) તથા મંજૂર કરેલ પ્લાન આપો આપ રદ થયેલ ગણાશે.

૧૮. ઓવરહેડ અને અન્ટરફાઉન્ડ પાણીની ટાંકી હવા શુસ્ત ઢાંકણથી બંધ રાખવી. ગટરની વેન્ટ પાઈપ ઉપર ઝીબું કપડું બાંધીને રાખવું અથવા પાતળા વાયરની જાંબી રાખવી. મેલેરીયા કર્મચારી માટે ઓવરહેડ ટાંકીની તપાસ માટે સીડીની વ્યવસ્થા કરવી.

૧૯. કન્સ્ટ્રક્શન / ડિમોલીશનની પ્રવૃત્તિ દરમ્યાન પ્લોટની દરેક બાજુએ ઓછામાં ઓછી ૩ મી. ઊંચાઈની પતરાની વાડ (બેરીકેડ) તથા બહુમાળી બિલ્ડિંગમાં ઉપરના માળના બાંધકામ સમયે ચારે બાજુ નેટ સેફટીનું પ્રોવીઝન સલામતિ જળવાઈ તે હેતુસર કરવાની રહેશે.

૨૦. RESPONSIBILITY (G.D.C.R. 4.3 & 4.4) : APPROVAL OF DRAWINGS AND ACCEPTANCE OF ANY STATEMENT, DOCUMENTS, STRUCTURAL REPORT, STRUCTURAL DRAWINGS, PROGRESS CERTIFICATE OR BUILDING COMPLETION CERTIFICATES SHALL NOT DISCHARGE THE OWNER, ENGINEER, ARCHITECT, CLERK OF WORKS/SITE SUPERVISOR, STRUCTURAL DESIGNER, DEVELOPER, OWNER FROM THEIR RESPONSIBILITIES. IMPOSED UNDER THE ACT, THE DEVELOPMENT REGULATIONS AND THE LAWS OF TORT AND LOCAL ACTS.

૨૧. LIABILITY (G.D.C.R. 3.3.1) : NOTWITHSTANDING ANY DEVELOPMENT PERMISSION GRANTED UNDER THE ACT AND THESE REGULATIONS, ANY PERSON UNDERTAKING ANY DEVELOPMENT WORK SHALL CONTINUE TO BE WHOLLY AND SOLELY LIABLE FOR ANY INJURY OR DAMAGE OR LOSS WHATSOEVER THAT MAY BE CAUSED TO ANY ONE IN OR AROUND THE AREA DURING SUCH CONSTRUCTION AND NO LIABILITY WHATSOEVER IN THIS REGARD SHALL BE CAST ON THE AUTHORITY OR ANY OFFICER.

૨૨. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના પત્ર ક્રમાંક નં. પરચ/૮૦૨૦૧૦/૬૩૨૫/પી.તા. ૧૬-૧૧-૨૦૧૦ ના પત્ર અનુસાર બાંધકામની જગ્યાએ મોટા અક્ષરે ગુજરાતી ભાષામાં બાંધકામની તમામ વિગતો દર્શાવતું બોર્ડ કાયમી મુકવાની શરતે.

૨૩. /આર્કિટેક્ટ/એન્જનીયર/સ્ટ્રક્ચરલ એન્જનીયર/ક્લાર્ક ઓફ વર્ક્સ (સાઈટ સુપરવાઈઝર)ની રહેશે તથા સંપૂર્ણ ખોદણકામ એક સાથે નહીં કરતા તબક્કાવાર કરી જરૂરી પ્રોટેક્ટીવ સપોર્ટ (Shoring/Supporting)ની વ્યવસ્થા કરી બાંધકામ કરવાનું રહેશે તથા ખોદણકામ/બાંધકામ દરમ્યાન આજુબાજુની જાનમાલ કે ચિલકતોની સલામતી માટે કરવાની જરૂરી વ્યવસ્થાનું એન્જનીયર/સ્ટ્રક્ચરલ એન્જનીયર/ક્લાર્ક ઓફ વર્ક્સ (સાઈટ સુપરવાઈઝર) દ્વારા સતત નિરીક્ષણ કરી જરૂર જણાય તો તાકીદે વધારાની વ્યવસ્થા કરવાની રહેશે તથા તે અંગે અરજદાર/માલિક/ડિવલપર્સ/આર્કિટેક્ટ/એન્જનીયર/સ્ટ્રક્ચરલ એન્જનીયર/ક્લાર્ક ઓફ વર્ક્સશ્રી દ્વારા આપેલ નોટરફાઈ બાંહેધરી મુજબ વર્તવાની શરતે તથા સ્થળે સલામતીના યોગ્ય પગલા લીધા સિવાય બાંધકામ/ખોદણકામ/ડિમોલીશનની કામગીરી કરવામાં આવતી જણાશે તો તાત્કાલીક અસરથી રજાચિઠ્ઠી સ્થગિત/રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તથા ખોદકામમાં નિકાલ થયેલ માટીથી તેમજ ઈમારતી માલસામાનના જાહેર માર્ગો પર થતા પરિવહન દરમ્યાન જાહેર માર્ગને નુકશાન થાય નહિ તે માટે જરૂરી જોગવાઈ કરવાની રહેશે..

ઉપર જણાવેલ કોઈપણ શરતોનો ભંગ થશે તો આપેલ બાંધકામનું આરંભ પ્રમાણપત્ર (રજાચિઠ્ઠી) રદ કરવામાં આવશે.

મ્યુ કમિશનરશ્રી,

આ કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજા ચીઠ્ઠી) દ્વારા જે વિકાસ કરવા પરવાનગી આપેલ છે તે અમે વિકાસ પ્લોટના અમલવા જે પ્લાન સાથે અરજી તેમજ બાંહેધરી રજૂ કરેલી તેના આધારે છે. માટે અરજીમાં કે પ્લાનમાં અમારા દ્વારા કરવામાં KIMARUDDIN SOMJI (CIVIL) નિયમો(જી.ડી.સી.આર.)ના નિયમો સાથે સુસંગત નહીં હોય તેમજ બાંહેધરી કે અરજીમાં અમારા દ્વારા કરવામાં આવેલ કુશળતા ખોટી હોય તે આ કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજા ચીઠ્ઠી) રદ થયેલી ગણાશે તથા કરેલ બાંધકામ અમારા ખર્ચે અને જોખમે અમદાવાદ ના નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ દૂર કરવા અમને કાયદાકીય કોઈપણ પ્રકારની નોટિસ કે જાણ કરવાની રહેશે નહીં. અમારા અધિકારીઓના ઇમેઇલ અને ફોન નંબરો નીચે મુજબ આપવામાં આવેલ છે અને તે સાથે અમે સંમત છીએ.

ઉપરોક્ત તમામ શરતો મેળવેલ છે અને તે સાથે અમે સંમત છીએ.

માલિક / અરજદારની સહી

અને એન્જનીયર / આર્કિટેક્ટની સહી.

LIC No. A.M.C. ER-0804040823 08

Thaltej, AHMEDABAD - 380019

નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ અમારા ખર્ચે અને જોખમે અમદાવાદ ના નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ દૂર કરવા અમને કાયદાકીય કોઈપણ પ્રકારની નોટિસ કે જાણ કરવાની રહેશે નહીં. અમારા અધિકારીઓના ઇમેઇલ અને ફોન નંબરો નીચે મુજબ આપવામાં આવેલ છે અને તે સાથે અમે સંમત છીએ.

Thaltej, AHMEDABAD - 380019

LIC No. A.M.C. ER-0804040823 08

નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ અમારા ખર્ચે અને જોખમે અમદાવાદ ના નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ દૂર કરવા અમને કાયદાકીય કોઈપણ પ્રકારની નોટિસ કે જાણ કરવાની રહેશે નહીં. અમારા અધિકારીઓના ઇમેઇલ અને ફોન નંબરો નીચે મુજબ આપવામાં આવેલ છે અને તે સાથે અમે સંમત છીએ.

Thaltej, AHMEDABAD - 380019

LIC No. A.M.C. ER-0804040823 08

નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ અમારા ખર્ચે અને જોખમે અમદાવાદ ના નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ દૂર કરવા અમને કાયદાકીય કોઈપણ પ્રકારની નોટિસ કે જાણ કરવાની રહેશે નહીં. અમારા અધિકારીઓના ઇમેઇલ અને ફોન નંબરો નીચે મુજબ આપવામાં આવેલ છે અને તે સાથે અમે સંમત છીએ.

Thaltej, AHMEDABAD - 380019

LIC No. A.M.C. ER-0804040823 08

નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ અમારા ખર્ચે અને જોખમે અમદાવાદ ના નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ દૂર કરવા અમને કાયદાકીય કોઈપણ પ્રકારની નોટિસ કે જાણ કરવાની રહેશે નહીં. અમારા અધિકારીઓના ઇમેઇલ અને ફોન નંબરો નીચે મુજબ આપવામાં આવેલ છે અને તે સાથે અમે સંમત છીએ.

Thaltej, AHMEDABAD - 380019

LIC No. A.M.C. ER-0804040823 08

નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ અમારા ખર્ચે અને જોખમે અમદાવાદ ના નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ દૂર કરવા અમને કાયદાકીય કોઈપણ પ્રકારની નોટિસ કે જાણ કરવાની રહેશે નહીં. અમારા અધિકારીઓના ઇમેઇલ અને ફોન નંબરો નીચે મુજબ આપવામાં આવેલ છે અને તે સાથે અમે સંમત છીએ.

Thaltej, AHMEDABAD - 380019

LIC No. A.M.C. ER-0804040823 08

નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ અમારા ખર્ચે અને જોખમે અમદાવાદ ના નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ દૂર કરવા અમને કાયદાકીય કોઈપણ પ્રકારની નોટિસ કે જાણ કરવાની રહેશે નહીં. અમારા અધિકારીઓના ઇમેઇલ અને ફોન નંબરો નીચે મુજબ આપવામાં આવેલ છે અને તે સાથે અમે સંમત છીએ.

Thaltej, AHMEDABAD - 380019

LIC No. A.M.C. ER-0804040823 08

નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ અમારા ખર્ચે અને જોખમે અમદાવાદ ના નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ દૂર કરવા અમને કાયદાકીય કોઈપણ પ્રકારની નોટિસ કે જાણ કરવાની રહેશે નહીં. અમારા અધિકારીઓના ઇમેઇલ અને ફોન નંબરો નીચે મુજબ આપવામાં આવેલ છે અને તે સાથે અમે સંમત છીએ.

Thaltej, AHMEDABAD - 380019

LIC No. A.M.C. ER-0804040823 08

નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ અમારા ખર્ચે અને જોખમે અમદાવાદ ના નાનકડા સુપરમાર્કેટ જોયેલ અને કરેલ બાંધકામ દૂર કરવા અમને કાયદાકીય કોઈપણ પ્રકારની નોટિસ કે જાણ કરવાની રહેશે નહીં. અમારા અધિકારીઓના ઇમેઇલ અને ફોન નંબરો નીચે મુજબ આપવામાં આવેલ છે અને તે સાથે અમે સંમત છીએ.